


ચાર્ચિતર વિદ્યામંડળ સંચાલિત
 વિહુલભાઈ પટેલ એન્ડ રાજરત્ન પી.ટી. પટેલ સાયન્સ કોલેજ
 વલ્લભ વિદ્યાનગર



લેબોરેટરી આસિસ્ટન્ટની લેખિત પરીક્ષા

TIME : 120 Min.

DATE : 29/09/2024, SUNDAY

TOTAL MARKS : 150

SEAT NO.

SUBJECT : CHEMISTRY/INDUSTRIAL CHEMISTRY

ઉમેદવારોને સૂચના

- 1) પરીક્ષા Multiple Choice Question (MCQ) પદ્ધતિની રહેશે.
- 2) દરેક પ્રશ્નનો 01 (એક) ગુણ રહેશે.
- 3) ખોટા જવાબ દીઠ, છેકાંડિકવાળા જવાબદીઠ કે એક કરતા વધુ વિકલ્પ પસંદ કરેલા જવાબદીઠ મેળવેલ ગુણમાંથી 0.25 ગુણ કમી કરવામાં આવશે, નેગેટીવ માર્કિંગ લાગુ પડશે.
- 4) પ્રશ્નના આપેલ બધા વિકલ્પોમાંથી કોઈ પણ વિકલ્પ પસંદ નહીં કરવામાં આવે તો, નેગેટીવ માર્કિંગ લાગુ પડશે નહીં.
- 5) સાચા વિકલ્પ ઉપર “O” વર્તુળ કરવું.

ઉદાહરણ તરીકે :

ભારતના રાષ્ટ્રપિતા તરીકે કોણ ઓળખાય છે ?

- A. સરદાર પટેલ B. મહાત્મા ગાંધી C. સુભાષચંદ્ર બોઝ D. વિનોબા ભાવે
- 6) આપ ગેરરીતી કે ગેરશિસ્ત આચરતાં હશો કે આપની પાસેથી બિન અધિકૃત પુસ્તકો, કાગળ, સાહિત્ય તથા મોબાઇલ, સ્માર્ટ લોચ, ડેલક્યુલેટર, પેનફ્રાઇલ વગેરે જેવા કોઈ પણ પ્રકારના વિજાણુંસાધનો મળી આવશે તો આપ ગેરલાયક ઠરશો, તેમજ આવી વસ્તુઓ જપ્ત કરવામાં આવશે.
 - 7) ચાલુ પરીક્ષા દરમ્યાન અંદરોઅંદર વાત કરવી, અવાજ કરવો કે સુપરવાઈઝરની સૂચનાઓનું ઉલ્લંઘન કરવું તે ગેરશિસ્ત ગણાશે.
 - 8) ઉમેદવારે વાદળી / કાળી પેનનો ઉપયોગ કરવાનો રહેશે.
 - 9) ઉમેદવારોને પરીક્ષા પૂર્ણ થયે જ પરીક્ષાખંડ છોડવા દેવામાં આવશે.
 - 10) પરીક્ષા પૂર્ણ થયે ઉમેદવારે આ પ્રશ્નપત્ર બ્લોક સુપરવાઈઝરશ્રીને આપવાનું રહેશે.

ઉમેદવારની સહી

બ્લોક સુપરવાઈઝરની સહી

- 1) ક્રાવણની સંક્રતા (Concentration) શું છે?
- ક્રાવણના આપેલા જથ્થામાં વિલાયકનું પ્રમાણ
 - ક્રાવણના આપેલા જથ્થામાં ક્રાવ્યનું પ્રમાણ**
 - ક્રાવણનો કુલ જથ્થો
 - ક્રાવ્યનું વજન
- 2) સોડિયમ હાઇડ્રોક્સાઇડનું સમતુલ્ય વજન (Equivalent weight) શું છે?
- 40 g/mol**
 - 20 g/mol
 - 60 g/mol
 - 80 g/mol
- 3) બોમિન પાણીનો ઉપયોગ કઈ પ્રક્રિયામાં થાય છે?
- હાઇડ્રોજનેશન
 - ઓક્સિડેશન
 - રિડક્શન**
 - હાલોજનેશન**
- 4) કઈ "ડાઇ" (Dyes) બેક્ટેરિયાને મારવા માટે ઉપયોગ થાય છે?
- કિસ્ટલ વાયોલેટ (Crystal Violet)**
 - મેથિલીન બ્લ્યુ (Methylene Blue)
 - કોન્ગો રેડ (Congo Red)
 - ઇન્ડિગો (Indigo)
- 5) Which of the following is a noun?
- Quickly
 - Beautiful
 - Apple**
 - Run
- 6) Which of the following is a pronoun?
- She**
 - Running
 - Quickly
 - Apple
- 7) Which word is a verb?
- Bright
 - Happiness
 - Slowly**
 - Jump**
- 8) Choose the correct preposition: "The car is parked _____ the house."
- Behind**
 - Under
 - Over
 - Next to

- 9) ભારતભરમાં સત્યાગ્રહનું પ્રચાર કરેવા માટે ખેડૂતો દ્વારા યોજાયેલું પ્રથમ સત્યાગ્રહ કયું હતું?
- A. કેદિયા સત્યાગ્રહ
 - B. ચંપારણા સત્યાગ્રહ
 - C. બારડોલી સત્યાગ્રહ
 - D. અહમદાબાદ મિલ સત્યાગ્રહ
- 10) 2021 માં ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે કોણે શપથ લીધા હતા?
- A. ભૂપેન્ધ્ર પટેલ
 - B. આનંદીબેન પટેલ
 - C. વિજય રૂપાણી
 - D. અમિત શાહ
- 11) ગુજરાતમાં ભાજપે પહેલીવાર કઈ સાલમાં સરકાર બનાવેલી હતી?
- A. 1990
 - B. 2001
 - C. 1995
 - D. 1985
- 12) ગુજરાત અને મહારાષ્ટ્રની વિભાજન પહેલા, આ રાજ્યનું નામ શું હતું?
- A. મદ્રાસ સ્ટેટ
 - B. સૌરાષ્ટ્ર સ્ટેટ
 - C. બોગ્યે સ્ટેટ
 - D. કાઠીયાવાડ સ્ટેટ
- 13) 1960માં ગુજરાતના મુખ્ય પ્રધાન કોણ બન્યા હતા?
- A. બલવંતરાય મહેતા
 - B. ઉચ્છંગરાય ઢીલા
 - C. જિવરાજ મહેતાએ
 - D. ઇન્દુલાલ યાજીક
- 14) ગુજરાતનું સૌથી ઊંચું શિખર કયું છે?
- A. સાપુતારા
 - B. ગિરનાર
 - C. પાવાગઢ
 - D. ઝરવાણી
- 15) નલ સરોવર કયા પ્રકારનું ક્ષેત્ર છે?
- A. પર્વતીય ક્ષેત્ર
 - B. જંગલ વિસ્તાર
 - C. રણ વિસ્તાર
 - D. પદ્મી અભયારણ્ય
- 16) કઈ નદી ગુજરાતની સૌથી લાંબી નદી છે?
- A. તાપી
 - B. સાબરમતી
 - C. માહી
 - D. નર્મદા
- 17) "હું" કયા પ્રકારનું સર્વનામ છે?
- A. પુરુષવાચક
 - B. નિશ્ચયવાચક
 - C. પ્રમાણવાચક
 - D. વ્યક્તિવાચક
- 18) "સિંહ" શબ્દ કયા લિંગમાં છે?
- A. સ્ત્રીલિંગ
 - B. નપુંસક લિંગ
 - C. પુરુંગ
 - D. ત્રિલિંગ

19) "ઉપકાર" શબ્દનો વિપરિત અર્થ શું છે?

A. ફૂટધનતા

B. સદાચાર

C. પુણ્ય

D. દાન

20) "મારો" કયા પ્રકારનું વિશેષજ્ઞ છે?

A. અધિકારવાચક

C. ગુણવાચક

B. સંખ્યાવાચક

D. કિયાવાચક

21) પદાર્થને સૂક્ષ્મ કણોમાં કેવી રીતે વિભાજિત કરવામાં આવે છે?

A. ડિસ્ટ્રીશન

C. ડિસ્ટ્રીલેશન

B. કણોગ

D. ગેરીક મિશ્રણ

22) API (Active Pharmaceutical Ingredients) અંદાજની ચોકસાઈને (Accuracy of API) ઘટાડતી પરિબળો શું છે?

A. રસાયણોની અશુદ્ધિ

B. સાધનોની ખામી

C. માપન કરનાર વ્યક્તિની ભૂલ

D. ઉપરના બધા

23) "હાઇડ્રોજનેશન" (Hydrogenation) પ્રક્રિયા એ મુખ્યત્વે કયા માટે થાય છે?

A. તેલને ઠંડુ રાખવા માટે

C. તેલને ધી જેવું બનાવવું

B. તેલમાં વધારે ફેટ ઉમેરવા

માટે

D. તેલમાંથી પાણી દૂર કરવા

માટે

24) ક્લાઉડ પોઇન્ટ (Cloud point) શું છે?

A. તે તાપમાન છે જ્યાં પેટ્રોલિયમ ઉત્પાદનમાં મીણ સ્ફિટિકો દેખાવાનું શરૂ કરે છે

B. તે તાપમાન છે જ્યાં પેટ્રોલિયમ ઉત્પાદન સ્થિર થાય છે

C. તે તાપમાન છે જ્યાં પેટ્રોલિયમ ઉત્પાદન પ્રવાહી બને છે

D. તે તાપમાન છે જ્યાં પેટ્રોલિયમ ઉત્પાદનનું વજન બદલાય છે

25) સલ્ફ્યુરિક એક્સિડનું સમતુલ્ય વજન (Equivalent weight) શું છે?

A. 49 g/mol

B. 98 g/mol

C. 48 g/mol

D. 89 g/mol

- 26) કયું દ્રવ્ય રંગદ્વયના 'ક્ષેત્રમાં 'મહત્વપૂર્ણ રીડક્શન એજન્ટ' (important reducing agent) તરીકે ઓળખાય છે?
- A. સોડિયમ સલ્ફાઈટ
 - B. સોડિયમ હાઇપોક્લોરાઈટ
 - C. હાઇટ્રોસલ્ફાઈટ
 - D. સોડિયમ કાબોનેટ
- 27) "સિન્થેટિક ડાઇ" (Synthetic Dyes) કઈ વસ્તુ ઉદ્યોગમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે?
- A. ક્રીપાસ
 - B. નાયલોન
 - C. રેશમ
 - D. પોલિએસ્ટર
- 28) જો $KMnO_4$ મોલેક્યુલર વજન 158 ગ્રામ/મોલ હોય તો, $KMnO_4$ નું સમતુલ્ય વજન (Equivalent weight) શું છે?
- A. 31.6 g/mol
 - B. 158 g/mol
 - C. 185 g/mol
 - D. 36.5 g/mol
- 29) નીચેનામાંથી, ગાંધીજીનું જન્મસ્થળ કયું છે?
- A. પોરબંદર
 - B. નડિયાદ
 - C. જૂનાગઢ
 - D. વલસાડ
- 30) ભારતનું બંધારણ બનાવનારે સંવિધાન સભાના અધ્યક્ષ કોણ હતા?
- A. ડૉ. બાબાસાહેબ આંબેડકર
 - B. સરદાર વલલભભાઈ પટેલ
 - C. જવાહરલાલ નહેંઠુ
 - D. ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
- 31) દાંડી સત્યાગ્રહ ક્યારે શરૂ થયું?
- A. 1931
 - B. 1930
 - C. 1932
 - D. 1933
- 32) દાંડી સત્યાગ્રહ દરમિયાન મહાત્મા ગાંધીએ કેટલા દિવસોમાં દાંડી પહોંચ્યું?
- A. 30
 - B. 24
 - C. 15
 - D. 10
- 33) HCl નું સમતુલ્ય વજન (Equivalent weight) શું છે?
- A. 36.5 g/mol
 - B. 65.3 g/mol
 - C. 25.3 g/mol
 - D. 56.3 g/mol
- 34) બ્રોમિન પાણીનો ઉપયોગ કઈ સંયોજનની શોધ માટે થાય છે? (detection of which compound?)
- A. આલ્કેન
 - B. આલ્કીન
 - C. એરોમેટિક સંયોજનો
 - D. ચાદીમાંથી કોઈ નથી

- 35) પાતળું પાડવાનો (Dilution of solution) સૂત્ર શું છે?
- A. $C_1V_1 = C_2V_2$ C. $V_1C_2 = V_1C_2$
 B. $C_1V_2 = C_2V_1$ D. $V_1V_2 = C_1C_2$
- 36) 1 N HCl દ્રાવણમાંથી, 100 mL ના 0.1 N HCl દ્રાવણ કેવી રીતે તૈયાર કરશો?
- A. 1 N HCl ના 10 mL ને 90 mL પાણી સાથે પાતળું કરો
 B. 1 N HCl ના 100 mL ને 900 mL પાણી સાથે પાતળું કરો
 C. 1 N HCl ના 1 mL ને 99 mL પાણી સાથે પાતળું કરો
 D. 1 N HCl ના 100 mL ને 100 mL પાણી સાથે પાતળું કરો
- 37) API (Active Pharmaceutical Ingredients) શું છે?
- A. દવાઓમાં વપરાતા સક્રિય પદાર્થો
 B. દવાઓમાં વપરાતા નિષ્ઠિય પદાર્થો
 C. દવાઓના ઉત્પાદનમાં વપરાતા રસાયણો
 D. દવાઓના ઉત્પાદનમાં વપરાતા સાધનો
- 38) ખાદ્ય તેલ નીકળવા માટે કયા પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે?
- A. ફિલ્ટરિંગ C. એસિડ
 B. તાપન અને દબાણ D. ઠંડક અને જમાવટ
- 39) કયા તેલમાં ઓમેગા-3 ફેટી એસિડની ઉપસ્થિતિ સૌથી વધુ હોય છે?
- A. ફલેક્સસીડ તેલ C. મસતર્ડ તેલ
 B. મગફળી તેલ D. સોયાબીન તેલ
- 40) ખાદ્ય તેલમાંથી ગંધ અને અશુદ્ધિઓ દૂર કરવા માટે કઈ પ્રક્રિયા કરવામાં આવે છે?
- A. ફિલ્ટરિંગ C. ન્યુટ્રલાઇઝેન
 B. ડિસમેલિંગ D. ડિકન્ટિંગ
- 41) ગુજરાતીમાં વર્તમાન કિયાપદનો સાચો ઉદાહરણ કયો છે?
- A. મેં ખાવું.
 B. હું ખાઉં છું.
 C. હું ખાતો હતો.
 D. હું ખાઈશ.
- 42) ગુજરાતીમાં કિયાપદના નિષ્ઠિય સ્વરૂપનો સાચો ઉદાહરણ કયો છે?
- A. પુસ્તક વાંચવામાં આવ્યું.
 B. તેણે પુસ્તક વાંચ્યું.
 C. તે પુસ્તક વાંચે છે.
 D. પુસ્તક વાંચ્યું હતું.
- 43) "સહનશક્તિ" નો વિરુદ્ધાર્થી શબ્દ લખો.
- A. શાંત
 B. ગુર્સો
 C. અસહનશક્તિ
 D. નરમ

- 44) "ઉતાવળ" નો વિરુદ્ધાર્થી શબ્દ લખો.
- A. જલ્દી
B. મોડુ
C. ધીરજ
D. શાંતિ
- 45) મોલારિટી (M) નો એકમ શું છે?
- A.** ગ્રાવણના એક લિટર દીઠ ગ્રાવ્યના મોલ
B. ગ્રાવણના એક લિટર દીઠ ગ્રાવ્યના ગ્રામ
C. વિલાયકના એક ગ્રામ દીઠ ગ્રાવ્યના ગ્રામ
D. વિલાયકના એક ગ્રામ દીઠ ગ્રાવ્યના મોલ
- 46) સોલ્વેન્ટ એક્સટ્રેક્શન (Solvent extraction) પદ્ધતિમાં કયા પદાર્થનો ઉપયોગ તેલ કાઢવા માટે થાય છે?
- A. પાણી
B. ઇથેનોલ
C. હેક્સેન
D. એસિટોન
- 47) એક પરીક્ષણમાં "ASTM" શું છે?
- A.** અમેરિકન સોસાયટી ફોર ટેસ્ટિંગ એન્ડ માર્ટિરિયલ્સ
B. એશિયન ધોરણ ફોર ટેસ્ટિંગ એન્ડ માર્ટિરિયલ્સ
C. આફિકન ધોરણ ફોર ટેસ્ટિંગ એન્ડ માર્ટિરિયલ્સ
D. ઓસ્ટ્રેલિયન ધોરણ ફોર ટેસ્ટિંગ એન્ડ માર્ટિરિયલ્સ
- 48) પોલિમરની સ્નિગ્ધતા (Viscosity of the Polymer) માપવા માટે કઈ પદ્ધતિઓનો ઉપયોગ થાય છે?
- A. કેપિલરી વિસ્કોસિમીટર (Capillary Viscometer)
B. રોટાશનલ વિસ્કોસિમીટર (Rotational Viscometer)
C. બબલ વિસ્કોસિમીટર (Bubble Viscometer)
D. ઉપરના બધા
- 49) કઈ આપત્તિ સૌથી વધુ જાનહાનિ કરે છે?
- A. પૂર
B. ચકવાત
C. ભૂકંપ
D. આગા
- 50) આપત્તિ વ્યવસ્થાપન માટે કઈ સંસ્થા જવાબદાર છે?
- A. રાષ્ટ્રીય આપત્તિ રાહત દળ (NDRF)
B. રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણ (NDMA)
C. રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન મંત્રાલય
D. રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સંસ્થા

- 51) પર્યાવરણના ઘટકો ક્યા છે?
- ભૌતિક અને રાસાયણિક
 - રાસાયણિક અને જૈવિક
 - ભૌતિક અને જૈવિક
- 52) પર્યાવરણના પ્રદૂષણના કારણો શું છે?
- ઉદ્યોગ અને વાહનો
 - વાહનો અને ખેતી
 - ઉદ્યોગ અને ખેતી
 - ઉદ્યોગો, વાહનો, ખેતી
- 53) રેડવુડ વિસ્કોસિમીટર (Redwood Viscometer) શું છે?
- પ્રવાહીની સાંક્રતા માપવા માટે વપરાતું સાધન
 - પ્રવાહીની સ્નિગ્ધતા માપવા માટે વપરાતું સાધન
 - પ્રવાહીનું વજન માપવા માટે વપરાતું સાધન
 - પ્રવાહીનું વોલ્યુમ માપવા માટે વપરાતું સાધન
- 54) પોર પોઇન્ટ (Pour Point) શું છે?
- તે તાપમાન છે જ્યાં પેટ્રોલિયમ ઉત્પાદન સ્થિર થઈને પ્રવાહી બનવાનું બંધ કરે છે
 - તે તાપમાન છે જ્યાં પેટ્રોલિયમ ઉત્પાદન પ્રવાહી બને છે
 - તે તાપમાન છે જ્યાં પેટ્રોલિયમ ઉત્પાદનનું વજન બદલાય છે
 - તે તાપમાન છે જ્યાં પેટ્રોલિયમ ઉત્પાદનમાં મીણ કિસ્ટલો દેખાવાનું શરૂ કરે છે
- 55) 'સ્પેક્ટ્રોસ્કોપી' એ કઈ પદ્ધતિ સાથે સંબંધિત છે?
- મિશ્રણના તત્વોનો વિશ્લેષણ
 - પદાર્થની ધૂવક મર્યાદા માપવી
 - પદાર્થની પ્રકાશ અવશોષણ અથવા નિરિજણ દ્વારા વિશ્લેષણ
 - પદાર્થના સૃષ્ટિ લક્ષણોને અભ્યાસ કરવો
- 56) "ક્રોમેટોગ્રાફી" શું થાય છે?
- પદાર્થના તાણ માપવા માટે
 - પદાર્થના ભાગોને અલગ કરવા માટે
 - પદાર્થની તાપમાન સુસંગતતા માટે
 - પદાર્થની દ્રાવ્યતા માટે

- 57) Choose the correct passive voice form: "Someone is cleaning the office."
- The office was cleaned by someone.
 - The office is cleaned by someone.
 - The office will be cleaned by someone.
 - D. The office is being cleaned by someone.**
- 58) Choose the correct option: "I need ___ time to finish my homework."
- | | |
|--------------------|-----------|
| A. Few | C. Little |
| B. A little | D. A few |
- 59) "કવાન્ટિટેટિવ એનાલિસિસ" (Quantitative analysis) એ કઈ પ્રકારની વિશ્લેષણને સંકેત આપે છે?
- | | |
|-----------------------|---------------------------|
| A. પદાર્થના ગુણવત્તા | C. પદાર્થની માત્રા |
| B. પદાર્થના દ્રાવ્યતા | D. પદાર્થના સંગ્રહની રીત |
- 60) કયા પદ્ધતિમાં પદાર્થના કણોની ગતિશીલતા નો આધાર લેવાય છે?
- | | |
|---------------------|----------------------------|
| A. સ્પેક્ટ્રોસ્કોપી | C. ઇલેક્ટ્રોફોરિસિસ |
| B. ક્રોમેટોગ્રાફી | D. પિપેટિંગ |
- 61) જો 500 મીલિલિટર (mL) 0.1 N NaCl સોલ્યુશન તૈયાર કરવું હોય, તો તમારે NaCl ના કેટલાય ગ્રામ જરૂરી છે? (NaCl નું MW 58.44 g/mol છે)
- | | |
|-------------------|------------|
| A. 2.922 g | C. 1.464 g |
| B. 5.844 g | D. 3.000 g |
- 62) "ડિસ્ટિલેશન" (Distillation) પદ્ધતિનો ઉપયોગ કયા પ્રકારની પદાર્થોને અલગ કરવા માટે થાય છે?
- | | |
|----------------------------------|-------------------|
| A. સોલિડ-સોલિડ મિશ્રણ | C. જેસ-જેસ મિશ્રણ |
| B. લિક્વિડ-લિક્વિડ મિશ્રણ | D. કોઈ વિકલ્પ નથી |
- 63) કિકેટમાં કયા દેશને "કિકેટના જન્મસ્થળ" તરીકે ઓળખવામાં આવે છે?
- | | |
|----------------|---------------------|
| A. ભારત | C. પાકિસ્તાન |
| B. ઓસ્ટ્રેલિયા | D. ઇંઝ્લેન્ડ |
- 64) વર્બલ તર્કની કસોટીમાં શું પરીક્ષણ થાય છે?
- | |
|--|
| A. રિત્રો અને આકૃતિઓનો ઉપયોગ કરવાની ક્ષમતા |
| B. તાકિક રીતે વિચારવાની ક્ષમતા |
| C. શબ્દો અને વાક્યોનો ઉપયોગ કરવાની ક્ષમતા |
| D. સમસ્યા હલ કરવાની ક્ષમતા |

- 65) તાકિક રીતે વિચારવા માટે કઈ કૌશલ્ત્યો જરૂરી છે?
- વિશ્લેષણ, સંશ્લેષણ અને મૂલ્યાંકન
 - વિશ્લેષણ અને સંશ્લેષણ
 - સંશ્લેષણ અને મૂલ્યાંકન
 - વિશ્લેષણ અને મૂલ્યાંકન
- 66) જાહેર વહીવટમાં સુશાસનનો અર્થ શું છે?
- સરકારી સંસ્થાઓનું કાર્યક્ષમ અને પારદર્શી સંચાલન
 - સરકારી નીતિઓનું ઝડપી અમલીકરણ
 - સરકારી સેવાઓનો ઝડપી અને સરળ પ્રાપ્તિ
 - ઉપરોક્ત તમામ
- 67) "સેન્સિટિવ રેએક્ટિવ" (Sensitive Reactive) પદ્ધતિ કઈ separation technique ને સંકેત કરે છે?
- સ્પેક્ટ્રોસ્કોપી
 - કોમેટોગ્રાફી
 - એલેક્ટ્રોફોરિસિસ
 - ઉપરોક્ત તમામ વિકલ્પો
- 68) "બાધ્યીભવન" પદ્ધતિ શું છે
- એકમ પ્રક્રિયા (Unit Process)
 - એકમ કામગીરી (Unit Operation)
 - એકમ પ્રક્રિયા અને કામગીરી બંને
 - ઉપરોક્ત તમામ વિકલ્પો
- 69) "સેન્ટ્રિફ્યુગેશન" પદ્ધતિનો ઉપયોગ કયારે થાય છે?
- સોલિડ-સોલિડ મિશ્રણને અલગ કરવા માટે
 - લિક્વિડ-લિક્વિડ મિશ્રણને અલગ કરવા માટે
 - અલગ પદાર્થોને ગતિશીલતાથી અલગ કરવા માટે
 - પદાર્થોના ડિસ્ટલાઇઝેશન માટે
- 70) "સોલ્યેન્ટ એક્સટ્રેક્ટન" પદ્ધતિનો ઉપયોગ કયા પ્રકારના પદાર્થોની નિર્વાહ માટે થાય છે?
- પદાર્થોની ડિસ્ટલાઇઝેશન
 - તેલ અને સુગંધિત પદાર્થોની નિર્વાહ
 - પદાર્થોના જૌતિક સ્વરૂપને બદલો
 - મિશ્રણના તાપમાન માપવું

- 71) "स्ट्रिम डिस्ट्रिलेशन" पद्धतिनो उपयोग कोने निर्वाह माटे थाय छे?
- ગ્રાવકમાંથી મિશ્રણને અલગ કરવું
 - જૈવિક કણોને અલગ કરવા માટે
 - C.** તેલ અને સુગાંધિત પદાર્થો કાઢવા માટે
 - પાણી અને ગેસને અલગ કરવું
- 72) આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડનું ડિસંગ્રેડિશન મિશ્રણ કેવી રીતે અલગો કરી શકાય?
- NaOH સાથે એસિડને ન્યૂટ્રોલાઇઝ કરીને
 - B.** NaHCO₃ સાથે એસિડને ન્યૂટ્રોલાઇઝ કરીને
 - NaOH સાથે એલ્કોહોલને ન્યૂટ્રોલાઇઝ કરીને
 - HCl સાથે એલ્કોહોલને ન્યૂટ્રોલાઇઝ કરીને
- 73) ફેનોલને બાયનરી મિશ્રણમાંથી કેવી રીતે અલગ કરી શકાય?
- A.** NaOH સાથે હળવી ગરમી આપીને
 - NaHCO₃ સાથે ગરમી આપીને
 - NaOH અને પછી HCl ઉમેરીને
 - H₂SO₄ ઉમેરીને
- 74) મિશ્રણમાં એલ્ડીહાઇડ અને કીટોન (Aldehyde & Ketone) કેવી રીતે ઓળખવા?
- A.** એલ્ડિહાઇડ Tollen's પરીક્ષણ આપે છે, જ્યારે કીટોન નથી
 - કીટોન Tollen's પરીક્ષણ આપે છે, જ્યારે એલ્ડિહાઇડ નથી
 - કીટોન NaOH સાથે પ્રતિક્રિયા કરે છે, જ્યારે એલ્ડિહાઇડ નથી
 - NaHCO₃ બંનેને ન્યૂટ્રોલાઇઝ કરે છે
- 75) Choose the correct option: "These apples are fresh. I'll take the green
____."
- A.** Ones
 - One
 - C. Some
 - D. This
- 76) એમાઈન અને ફેનોલ બાયનરી મિશ્રણમાંથી કેવી રીતે અલગ થાય છે?
- HCl સાથે ફેનોલને દૂર કરીને
 - B.** HCl સાથે એમાઈનને દૂર કરીને
 - NaHCO₃ સાથે ફેનોલને દૂર કરીને
 - HCl સાથે ફેનોલને દૂર કરીને

- 77) કઈ પદ્ધતિનો ઉપયોગ શાકભાજુ તેલ નીકળવા માટે થાય છે?
- A. કેમીકલ શુદ્ધિકરણ
 - B. હાઇડ્રોલિસિસ
 - C. સોલ્વેન્ટ એક્સ્ટ્રેક્શન
 - D. વિમલન
- 78) તેલને શુદ્ધ કરવા માટે કઈ પ્રક્રિયા ઉપયોગમાં લેવાય છે?
- A. ડિસ્ટિલેશન
 - B. રિફાઇનિંગ
 - C. કાર્બનાઇઝેશન
 - D. પાવડર મિક્સિંગ
- 79) કયા પ્રકારના પોલિમરનું ફરીથી ઉપયોગ કરી શકાય છે?
- A. થમોપ્લાસ્ટિક
 - B. થમોસેટ
 - C. પોલિઅસ્ટર
 - D. પોલિથિન
- 80) "દ્રેષ" નો વિરુદ્ધાર્થી શબ્દ લખો.
- A. પ્રેમ
 - B. શાંતિ
 - C. કંકાશ
 - D. રાગ
- 81) નીચેના શબ્દોમાંથી, સાચી જોડણી શોધો અને તેને ચિહ્નિત કરો
- A. કમચારી
 - B. કમચારી
 - C. કાર્મચારી
 - D. કર્મચારી
- 82) નીચેના શબ્દોમાંથી, સાચી જોડણી શોધો અને તેને ચિહ્નિત કરો
- A. નિરાત
 - B. નિરાંત
 - C. નીરત
 - D. નીરાંત
- 83) નીચેના શબ્દોમાંથી, સાચી જોડણી શોધો અને તેને ચિહ્નિત કરો
- A. દીવ્યતા
 - B. દિવ્યતા
 - C. દિવ્યત
 - D. દિવ્યત
- 84) કયો પોલિમર ઇલેક્ટ્રોકલ ઇન્સ્યુલેશન માટે ઉપયોગી છે?
- A. પોલિપ્રોપિલિન
 - B. પોલિસ્ટ્રિન
 - C. પોલી વિનાઇલ ક્લોરાઇડ
 - D. નાયલોન
- 85) લેસેની ટેસ્ટ (Lassaigne's Test) કયા મેટલનો ઉપયોગ નાઇટ્રોજન, ગંધક અને ફેલોજન તત્વોની ઓળખ માટે થાય છે?
- A. સોડિયમ
 - B. પોટેશિયમ
 - C. લિથિયમ
 - D. બેરિયમ

- 86) તેલ નિર્જર્ખણ નો કથો કમ યોગ્ય છે?
- બીજનો પાઉડર, ગરમી, તેલ
 - બીજનો પાઉડર, દબાણ, તેલ**
 - બીજ, ગરમી, પાઉડર
 - બીજ, પાણી, તેલ
- 87) કયું સાધન રસાયણોનું ચોક્કસ પ્રમાણ માપવા માટે ઉપયોગમાં લેવાય છે?
- બીકર
 - બ્યુરેટ**
 - C. ફલાસ્ક
 - D. ટેબલ બેલેન્સ
- 88) કોઈ પ્રતિક્રિયાની મોલેક્યુલરિટી શું હોઈ શકે છે?
- ભાગ્યક
 - શૂન્ય
 - C. પુર્ણિક**
 - અનંત
- 89) નોર્માલિટી (Normality) નું પ્રમાણ શું છે?
- મોલ દીઠ દ્રવ્યનું વજન
 - મોલ દીઠ ક્રાવણનું વજન
 - મોલ દીઠ સમાન આવશ્યક તત્ત્વો
 - D. લિટર દીઠ સમાન ગ્રામ ઇક્વિવેલન્ટ**
- 90) સ્ટાન્ડર્ડ એસિડ સોલ્યુશનને તૈયાર કરતી વખતે સૌથી મહત્વપૂર્ણ પરિબળો કયા છે?
- તાપમાન અને દબાણ
 - ક્રાવણનો પીએચ
 - એસિડ અને પાણીનું પાયમાનું
 - D. મોલક વજન અને વોલ્યુમ**
- 91) જો કોઈ તત્ત્વનું અણુભાર 40 અને આવશ્યકતા 2 છે, તો તેનો સમાન વજન (Equivalent Weight) શું હશે?
- A. 20**
 - 40
 - 80
 - 2
- 92) નીચેનામાંથી સૌથી જે સૌથી લાંબી નદી છે?
- નર્મદા નદી
 - નિલ નદી**
 - મિસિસિપી નદી
 - યંગત્સે નદી
- 93) વિશ્વનો સૌથી મોટો દેશ કયો છે?
- રષ્યા**
 - ચીન
 - યુનાઇટેડ સ્ટેટ્સ
 - ભારત

- 94) આલ્યુમિનિયમ (Al) નો સમાન વજન (Equivalent Weight) શું છે? (Atomic Weight = 27, Valency = 3)

 - A. 9
 - B. 27
 - C. 3
 - D. 18

95) ક્રો સૂત્ર અણુભાર અને મોલાર દ્રવ્ય સાથે જોડાય છે?

 - A. અણુભાર = મોલાર દ્રવ્ય \times અવોગાડ્રો સંખ્યા
 - B. અણુભાર = મોલાર દ્રવ્ય / અવોગાડ્રો સંખ્યા
 - C. અણુભાર = મોલાર દ્રવ્ય / ઘટક સંખ્યા
 - D. અણુભાર = મોલાર દ્રવ્ય \times 100

96) લેસૈની ટેસ્ટ (Lassaigne's Test) સોડિયમ ફ્લ્યુઝની પ્રતિક્રિયા પછી કયું ગ્રાવણ ઉમેરીને નાઈટ્રોજનને ઓળખી શકાય છે?

 - A. ફેરિક ક્લોરાઇડ
 - B. પોટેશિયમ પર્મેનેટ
 - C. ફેરોસલ્ફેટ અને ફેરિક ક્લોરાઇડ
 - D. સિલ્વર નાઈટ્રેટ

97) પદાર્થના ધનત્વ માપવા માટે ક્રો ઉપકરણ વપરાય છે?

 - A. હાઇડ્રોમીટર
 - B. સ્પેક્ટ્રોમીટર
 - C. પિપેટ
 - D. મીનીસ્ક્સ

98) વિશ્વનો સૌથી મોટો મહાસાગર ક્રો છે?

 - A. અટલાન્ટિક મહાસાગર
 - B. હિંદ મહાસાગર
 - C. પ્રશાંત મહાસાગર
 - D. આર્કિટ્ક મહાસાગર

99) એક્સેલમાં "=SUM(A1:A10)" શું કરે છે?

 - A. A1 થી A10 સેલ્સના મૂલ્યોનો ગુણાકાર કરે છે
 - B. A1 થી A10 સેલ્સના મૂલ્યોનો ભાગાકાર કરે છે
 - C. A1 થી A10 સેલ્સના મૂલ્યોનો સરવાળો કરે છે
 - D. A1 થી A10 સેલ્સના મૂલ્યોનો બાદબાકી કરે છે

100) રસાયણિક પ્રક્રિયાઓ માટે લેબોરેટરીમાં કઈ ગેસ મુખ્યત્વે ઉપયોગમાં લેવાય છે?

 - A. હાઇડ્રોજન
 - B. મિથેન
 - C. નાઈટ્રોજન
 - D. ઓક્સિજન

- 101) $2N H_2SO_4$ સોલ્યુશન માં, H_2SO_4 ના કેટલા મોલ્સ હશે?
- A. 1 મોલ
 - B. 2 મોલ
 - C. $1/2$ મોલ
 - D. $2/3$ મોલ
- 102) સાઇઝ રિડક્ષનના (Size Reduction) લક્ષ્ય માટે કયા પદ્ધતિનું ઉપયોગ કરુણોને અલગ (Particles separate) કરવા માટે થાય છે?
- A. સબલિમેશન
 - B. સેન્ટ્રીફ્યુગેશન
 - C. ડિસ્ટિલેશન
 - D. કિસ્ટલાઇઝેશન
- 103) 10% (w/v) NaCl સોલ્યુશન નો અર્થ શું છે?
- A. 10 ગ્રામ NaCl 100 મીલીલિટર સોલ્યુશનમાં
 - B. 10 ગ્રામ NaCl 1000 મીલીલિટર સોલ્યુશનમાં
 - C. 10 મોલ NaCl 1 લિટર સોલ્યુશનમાં
 - D. 10 મિલિએક્વિવેલન્ટ NaCl 1 લિટર સોલ્યુશનમાં
- 104) એક્સેલમાં ચાર્ટ શું છે?
- A. ટેક્સ્ટ સ્ટ્રિંગ
 - B. નંબર
 - C. ડેટાનું રશ્ય રજૂઆત
 - D. ઓપરેશન કરવા માટેનું સૂત્ર
- 105) એક્સેલમાં ફિલ્ટરનો ઉપયોગ શા માટે થાય છે?
- A. ડેટાને સોટ કરવા માટે
 - B. ડેટાને શોધવા માટે
 - C. ડેટાને ફોર્મેટ કરવા માટે
 - D. ડેટાને દર્શાવવા માટે
- 106) કલાઉડ પોઇન્ટ અને પોર પોઇન્ટ માપવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે?
- A. કોન્સ્ટન્ટ ટેમ્પરેચર બાથ પદ્ધતિ
 - B. હાઇડ્રોમીટર પદ્ધતિ
 - C. સ્પેક્ટ્રોફોટોમેટ્રી પદ્ધતિ
 - D. ટાઇટ્રેશન પદ્ધતિ
- 107) વિશ્લેષણાત્મક રસાયણશાસ્ત્રમાં 'ટાઇટ્રેશન' શું છે?
- A. એક દ્રાવક દ્વારા પદાર્થને ત્વરિત કરવું
 - B. એક પદાર્થની માત્રા માપવા માટે પદાર્થને નમૂનાઓ સાથે માપવું
 - C. પદાર્થને તાપમાનમાં ફેરફાર કરવું
 - D. પદાર્થને વિશીષ તેજસ્વિત પદ્ધતિથી શોધવું

- 108) "મોલારિટી" (M) ની વ્યાખ્યા શું છે?
- પદાર્થના મોલ્સ પ્રતિ 1 લિટર સોલ્યુશન
 - પદાર્થના ગ્રામ પ્રતિ 1 મીલીલિટર સોલ્યુશન
 - પદાર્થની ક્રાવ્યતા
 - પદાર્થનો વોલ્યુમ
- 109) Active Charcoal નો ઉપયોગ કયા પ્રકારના નિર્વાહ માટે થાય છે?
- સોલિડ ઘટકોને અલગ કરવું
 - પદાર્થની કલર દૂર કરવું માટે
 - સુગંધિત પદાર્થને ફિલ્ટર કરવું
 - તેલને પદાર્થમાંથી દૂર કરવું
- 110) Choose the correct option: "Who owns ____ bicycles over there?"
- This
 - Those
 - That
 - These
- 111) "સોડિયમ બાઇકાર્બોનેટ" નો ઉપયોગ કયા પ્રકારના ઓર્ગેનિક મિશ્રણને અલગ કરવા માટે થાય છે?
- એસિડિક અને બેજિક ઓર્ગેનિક પદાર્થોને
 - મિશ્રણમાં આવેલા પદાર્થોની તાપમાન માપવા માટે
 - પદાર્થોની ગંધને દૂર કરવા માટે
 - પદાર્થોની રંગતને માપવા માટે
- 112) આલ્કિલ બેન્ઝેન (Alkyl benzene) Preparation માટે કયા પદ્ધતિનો ઉપયોગ થાય છે?
- ફિડેલ-કાફ્ટર્સ એલ્કિલેશન
 - ડીકબોક્સિલેશન
 - વિમલન
 - હાઇડ્રોલિસિસ

- 113) પદાર્થને નાના કણોમાં બનાવવા માટે કયો પદ્ધતિ શ્રેષ્ઠ છે?
- કિસ્ટલાઇઝેશન
 - મિક્સિંગ
 - મિકાનિકલ ગ્રાઇડિંગ**
 - વિમલન
- 114) "ડિસ્ટિલેશન" અને "ફેક્શનલ ડિસ્ટિલેશન" માંનો મુખ્ય તફાવત શું છે?
- ડિસ્ટિલેશન સરળ મિશ્રણને અલગ કરે છે, જ્યારે ફેક્શનલ ડિસ્ટિલેશન જટિલ મિશ્રણને
 - ફેક્શનલ ડિસ્ટિલેશન મિશ્રણને સરળ બનાવે છે, જ્યારે ડિસ્ટિલેશનને જટિલ બનાવે છે
 - ડિસ્ટિલેશન માત્ર સોલિડ પદાર્થને અલગ કરે છે, જ્યારે ફેક્શનલ ડિસ્ટિલેશન લિક્વિડ પદાર્થને
 - ડિસ્ટિલેશન સેટિંગ જરૂરી છે, જ્યારે ફેક્શનલ ડિસ્ટિલેશન લેબોરેટરી ઉપયોગ માટે છે.
- 115) કઈ સંખ્યાના 20% બરાબર 50 થાય?
- 100
 - 150
 - C. 200
 - D. 250**
- 116) જો એક વસ્તુ રૂ 1200 માં ખરીદી ને રૂ 1104 માં વેચતા, કેટલા ટકાનું નુકસાન થયું કહેવાય?
- 5
 - 6
 - C. 9
 - D. 8**
- 117) કયું ઉદાસીન વાયુ (Noble gases) લાઇટ બલ્બમાં ભરવામાં આવે છે?
- ઓર્ગોન
 - ઓક્સિજન
 - C. કાર્બન ડાઇઓક્સાઇડ
 - હીલીયમ
- 118) સેમી-માઇક્રો inorganic વિશ્લેષણમાં કયા માપના નમૂનાઓ લેવામાં આવે છે?
- 10 mg
 - 100 mg**
 - 500 mg
 - 5 g
- 119) કયા પરીક્ષણથી હલકા ધાતુઓના ધાતુઓને ઓળખી શકાય છે?
- આગના પરીક્ષણથી
 - લીટમસ પેપર પરીક્ષણ
 - કાચનું પરીક્ષણ
 - કાર્બનના પરીક્ષણ

120) Zn^{2+} આયનને ઓળખવા (Identification) માટે કયો ચકાસણો (test) કરવામાં આવે છે?

- A. $NaOH$ સાથે સંફેદ અવક્ષેપ
- B. NH_4Cl સાથે પીળો અવક્ષેપ
- C. $K_4[Fe(CN)_6]$ સાથે લાલ અવક્ષેપ
- D. HCl સાથે લીલો અવક્ષેપ

121) કોઈ તત્વનું સમાન વજન (Equivalent Weight) કેવી રીતે ગણાય છે?

- A. અણુભાર / આવશ્યકતા
- B. મોલાર દવ્ય \times આવશ્યકતા
- C. મોલાર દવ્ય / પદાર્થનું ઘનત્વ
- D. આવશ્યકતા / અણુભાર

122) "500 મીલીલિટર (ml) 0.5 M HCl" તૈયાર કરવા કેટલા મીલીલિટર "2 M HCl" ની જરૂર પડશે?

- A. 125 મીલીલિટર
- B. 250 મીલીલિટર
- C. 100 મીલીલિટર
- D. 150 મીલીલિટર

123) ઓર્ગેનિક મોલેક્યુલરમાં (Organic Molecules) નાઇટ્રોજનની હાજરી કેવી રીતે ઓળખી શકાય છે?

- A. ડાયમિન-ઓટમોલ સોલ્યુશન દ્વારા
- B. લિટમસ પેપર દ્વારા
- C. Lassaigne's Test
- D. નાયદ્રેટ વાયદા

124) બિનસંતૃપ્ત કાર્ਬનિક સંયોજનોમાં કયો પરીક્ષણ બિનસંતૃપ્ત બંધોને ઓળખે છે?

- A. બ્રોમાઇન પાણી પરીક્ષણ
- B. ફેરીક ક્લોરાઇડ પરીક્ષણ
- C. ટોલેન્સ પરીક્ષણ
- D. બેન્ડિક્ટ પરીક્ષણ

125) નીચેના શબ્દોમાંથી, સાચી જોડણી શોધો અને તેને ચિહ્નિત કરો!

- A. પ્રશંશા
- B. પ્રસંશા
- C. પ્રસંશા
- D. પ્રસ્નાશા

126) "સાઈ જીવનની રેંગોળી" આ પંક્તિ કયા પાઠ સાથે સંકળાયેલી છે?

- A. મહાત્મા ગાંધી
- B. પ્રભાત
- C. આનંદીબહેન
- D. આકાશ

↑ Name of These

- 127) "હું જગતને પ્રેમ કરું છું" આ લેખનનું લેખક કોણ છે?
- A. મહાત્મા ગાંધી C. કાન્દીલાલ જાવેરી
 B. અવેરચંડ મેઘાણી D. નર્મદ
- 128) બાયનરી મિશ્રણમાંથી કાર્బનિક એસિડને અલગ કરવા માટે કયા વિધાન ઉપયોગ થાય છે?
- A. NaOH C. NaHCO_3
 B. HCl D. H_2SO_4
- 129) કઈ તેલ મેળવવાની પદ્ધતિ શ્રેષ્ઠ ગુણવત્તાનું તેલ આપશે?
- A. સોલ્વેન્ટ એક્સ્ટ્રેક્શન C. કોલ્ડ પ્રેસિંગ
 B. હીટ પ્રેસિંગ D. કાયમી પ્રેસિંગ
- 130) "લિક્વિડ-લિક્વિડ એક્સ્ટ્રાક્શન" પદ્ધતિનો ઉપયોગ શું માટે થાય છે?
- A. આઇસોલેશન અને શુદ્ધિકરણ (Isolation and Purification)
 B. પદાર્થને ગરમ કરીને તેની પાનીને દૂર કરવા માટે
 C. સોલિડ પદાર્થોને પાઇપેટ વડે વહન કરવા માટે
 D. લિક્વિડ પદાર્થોને ડિસ્ટલાઇઝ કરવાના
- 131) કયો ગુણ પોલિમરની ગુણવત્તા નક્કી કરે છે?
- A. વજન C. મોલેક્યુલર વજન
 B. સાંક્રતા D. ધનતા
- 132) "પ્રભાત" કાવ્યના કવિ કોણ છે?
- A. મકરંદ દવે C. મકરંદ દવે
 B. નરસિંહ મહેતા D. ઉમાશંકર જોશી
- 133) "ગાંધીબાપુના ચમકારા" પાઠના લેખક કોણ છે?
- A. માધવ રામાનુજ C. મકરંદ દવે
 B. અવેરચંડ મેઘાણી D. ઉમાશંકર જોશી
- 134) કયા ઉપકરણનો ઉપયોગ માપવા માટે થાય છે?
- A. બીકર C. બ્યુન્સન બર્નર
 B. બ્યુરેટ D. પિપેટ
- 135) કયા સમૂહના test માટે સિલ્વર નાઇટ્રેટ (AgNO_3) ટેસ્ટ કરવામાં આવે છે?
- A. કાર્બોનેટ C. સલ્ફેટ
 B. ક્લોરાઇડ D. નાઇટ્રેટ

- 136) કયા પાત્રનો ઉપયોગ લેબોરેટરીમાં પ્રવાહી ઉકળવા માટે થાય છે?
- A. બીકર
 - C. ક્યુવેટ
 - B. ફલાસ્ક
 - D. ટિફેટર
- 137) લેબોરેટરીમાં કયો ઉપકરણ માપવામાં આવતો પ્રવાહીનું ચોક્કસ પ્રમાણ દર્શાવે છે?
- A. પાઇપેટ
 - C. બ્યુરેટ
 - B. બ્યુન્સન બર્નર
 - D. બીકર
- 138) ₹ 1,000 નું 6% લેઝે ત્રણ માસ નું વ્યાજ કેટલું થાય?
- A. ₹ 05
 - C. ₹ 10
 - B. ₹ 15
 - D. ₹ 25
- 139) 1, 4, 9, 16,?
- A. 30
 - C. 35
 - B. 20
 - D. 25
- 140) 2 મોલ/લિટર ફ્રોમેલિટી ધરાવતું ગ્રાવણ શું દર્શાવે છે?
- A. ગ્રાવણમાં 2 મોલ દ્રવ્ય છે
 - B. ગ્રાવકમાં 2 ગ્રામ દ્રવ્ય છે
 - C. ગ્રાવણમાં 1 મોલ દ્રવ્ય છે
 - D. ગ્રાવણમાં 0.5 મોલ દ્રવ્ય છે
- 141) ફૂટ્રિમ રીતે ઇથેનોલ કેવી રીતે તૈયાર (Preparation of synthetic ethanol) કરી શકાય છે?
- A. ઇથેનના હાઇડ્રેશનમાં
 - B. મિથેનના હાઇડ્રેશનથી
 - C. પ્રોપેનના ઓક્સિડેશનથી
 - D. બ્યુટેનના વિમલનથી
- 142) બે ઓર્ગેનિક તત્વોને કિસ્ટલાઇઝન કરા અલગ કરવા માટે કયો ગુણધર્મ ઉપયોગી છે?
- A. ઉકાળાનો બિંદુ
 - B. ઓગાળવાનો બિંદુ
 - C. દબાણ
 - D. ઘનતા

- 143) કયા પ્રકારની મિલ સાઇઝ રિડક્શન માટે ખાસ કરીને યોગ્ય છે?
- હમર મિલ (Hummer Mill)
 - રોલ મીલ (Roll Mill)
 - C. બાઉલ મીલ (Bowl Mill)**
 - વેઇટ મીલ (Weight Mill)
- 144) "ભક્તિ પરંપરા"નો મુખ્ય કવિ કોણ હતો?
- અક્ષરધામ
 - દયારામ
 - C. મકરંદ દવે**
 - D. નરસિંહ મહેતા**
- 145) ગુજરાતી સાહિત્યના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે?
- A. નરસિંહ મહેતા**
 - પ્રેમાનંદ
 - ઉમાશંકર જોશી
 - કવિ નર્મદ
- 146) 'મહાત્મા નાજુકબંધના' આ વાક્ય કોણે લખ્યું છે?
- A. મહાત્મા ગાંધી**
 - રવીન્દ્રનાથ ટાગોર
 - C. નર્મદ
 - D. કવિ નર્મદ
- 147) Which sentence uses the correct article?
- A. They live in the big house.**
 - B. I saw a stars in the sky.
 - C. She is an best student in the class.
 - D. We bought a apples from the market.
- 148) Choose the correct option: "____ is my house across the street."
- These
 - Those
 - C. That**
 - This
- 149) ન્યુટ્રલ FeCl_3 ટેસ્ટ કયા પ્રકારના સંયોજનો માટે નકારાત્મક પરિણામ આપે છે?
- ફેનોલ્સ
 - B. આલ્કોહોલ**
 - કાબોક્સિલિક એસિડ
 - એસ્ટર
- 150) NaCl નું 1 M દ્રાવણ કેવી રીતે તૈયાર કરશો?
- A. 58.44 ગ્રામ NaCl ને 1 લિટર પાણીમાં ઓગાળો**
 - 58.44 ગ્રામ NaCl ને 100ml પાણીમાં ઓગાળો
 - 58.44 ગ્રામ NaCl ને 10ml પાણીમાં ઓગાળો
 - 58.44 ગ્રામ NaCl ને 1000 ગ્રામ methanol માં ઓગાળો